

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર લવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની વિવિધ કામગીરી અંગે બેઠક યોજતા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ

નાયબ કમિશનરશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ સાથે યોજાયેલી મીટીંગમાં ગહન પરામર્શ કરાયો

તારીખ: ૦૭-૦૫-૨૦૨૧



આવનારા સમયમાં યોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી લગત વિવિધ

મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવા અંગે આજ રોજ તા. ૦૭-૦૫-૨૦૨૧ ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને વિવિધ શાખાના સંબંધિત અધિકારીશ્રીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી. સંબંધિત અધિકારીશ્રીમાં ત્રણેય ઝોનના નાયબ કમિશનરશ્રીઓ શ્રી બી.જી.પ્રજાપતિ, શ્રી એ.આર.સિંઘ અને શ્રી સી.કે.નંદાણી, ટાઉન પ્લાનરશ્રી-ઇ.યા. ,આસિ. ટાઉન પ્લાનરશ્રી (તમામ ઝોન) , પર્યાવરણ ઇજનેરશ્રી , નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી (તમામ ઝોન) , ઝોનલ સિટી એન્જી.શ્રી , વોર્ડ એન્જી.શ્રી, વોર્ડ ઓફીસરશ્રી, ઝોનલ સિટી એન્જી.શ્રી , વોર્ડ એન્જી.શ્રી, વોર્ડ ઓફીસરશ્રી, આસિ. કમિશનરશ્રી અને આસિ. મેનેજરશ્રી(એસ્ટેટ તથા દબાણ હટાવ) , ઝોનલ સિટી એન્જી.શ્રી , ટાઉન પ્લાનરશ્રી-ઇ.યા. , આસિ. ટાઉન પ્લાનરશ્રી (તમામ ઝોન) , ડાયરેક્ટરશ્રી(પાર્કસ એન્ડ ગાર્ડન) , એડી.સિટી એન્જી.શ્રી(ઇલે./મિકે.)-ઇ.યા., ડી.ઇ.ઇ.શ્રી(વર્કશોપ), ઝોનલ સિટી એન્જી.શ્રી , વોર્ડ એન્જી.શ્રી , વોર્ડ ઓફીસરશ્રી , ચીફ ફાયર ઓફીસરશ્રી-ઇ.યા. , ડી.ઇ.ઇ.શ્રી(વર્કશોપ), ચીફ ફાયર ઓફીસરશ્રી-ઇ.યા., ડી.ઇ.ઇ.શ્રી(વર્કશોપ), ચીફ ફાયર ઓફીસરશ્રી-ઇ.યા., ચીફ ફાયર ઓફીસરશ્રી-ઇ.યા., ઝોનલ સિટી એન્જી.શ્રી, ચીફ ફાયર ઓફીસરશ્રી-ઇ.યા., વોર્ડ એન્જી.શ્રી અને વોર્ડ ઓફીસરશ્રી , સંબંધિત સહાયક કમિશનરશ્રી , સુરક્ષા અધિકારીશ્રી, ચીફ ફાયર ઓફીસરશ્રી-ઇ.યા., શાસનાધિકારીશ્રી, સંબંધિત સહાયક કમિશનરશ્રી , મેડીકલ ઓફીસર ઓફ હેલ્થશ્રી-ઇ.યા., પર્યાવરણ ઇજનેરશ્રી-ઇ.યા., ઝોનલ સિટી એન્જી.શ્રી, સંબંધિત સહાયક કમિશનરશ્રી, ચીફ ફાયર ઓફીસરશ્રી-ઇ.યા., ડી.ઇ.ઇ.શ્રી(સેન્ટ્રલ વર્કશોપ) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મ્યુનિ. કમિશનરશ્રીએ મીટિંગની શરૂઆત કરતા વિવિધ મુદ્દાઓ અંગે આવનાર સમયમાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા અંગે સંબંધિત અધિકારીશ્રી પાસેથી માહિતી મેળવી હતી. ચોમાસા દરમિયાન આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી આગળ ધપાવવા તૈયારી શરૂ કરવા જે તે શાખાના અધિકારીશ્રીને સુચના આપી હતી.

મ્યુનિ. કમિશનરશ્રીએ પ્રિ-મોન્સુન માટે કરવાની થતી કામગીરી જેવી કે, પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કરી GSDMA અને રિલીફ કમિશનરશ્રીને મોકલવા તથા પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ , કર્મચારીઓ, બિલ્ડિંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડિંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી , વૉકળામાંથી દબાણ દુર કરાવવું , બાઉન્ડ્રી ડીમાર્કેશન કરાવવું, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો , ખાનગી જોખમી હોર્ડિંગ અંગેની કામગીરી, વૉકળા સફાઇ, ડ્રેનેજ ફરિયાદનો તાત્કાલિક નિકાલ અંગે સુચના આપેલ.

પીવાના પાણીને લગત ફરીયાદો તથા તેના નિકાલના આયોજન , જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો , રસ્તા ઉપરના દબાણો , જોખમી હોર્ડિંગની માહિતી , ભયગ્રસ્ત મકાનોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી , જાહેર માર્ગો , બગીચાઓ વિગેરે જગ્યાના જોખમી વૃક્ષોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી , ભયગ્રસ્ત તેમજ તુટી પડે તેવા પોલ , ઇલેક્ટ્રીક કેબલ વિગેરેની માહિતી તેમજ ભારે વરસાદ , વાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્યારે તેની

અવેજીમાં ડિઝલ જનરેટર વિગેરેની વ્યવસ્થા , રસ્તા પરના ખાડા , ખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહી , GSDMA દ્વારા ERC માટે ફાળવેલ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ હસ્તકના વાહનો તથા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્થિતિમાં રાખવા અંગે કરવાની થતી કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા , પંપ વિકેતાઓની યાદી-ફોન નંબર , ઉપલબ્ધ પંપની વિગત , વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું વિગેરેની ચર્ચા કરેલ.

આ ઉપરાંત શહેર આસપાસના વિસ્તારો, ગામોમાં રહેતા તરવૈયાઓની નામ, સરનામા, ફોન નંબર સાથેની યાદી અદ્યતન કરવી , શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવા તથા તેના તાત્કાલિક નિકાલના આયોજનની વિગતો , વર્ષ-૨૦૨૦માં જુદા-જુદા વિસ્તારો - માર્ગો વિગેરે ઉપર પાણી ભરાવાની મળેલ ફરિયાદોની માહિતી પરથી આયોજન, પુર, વાવાઝોડું વિગેરે કુદરતી આપત્તિ સમયે ચેતવણી વિગેરે તેમજ જાન-માલ બચાવની કામગીરી , વાહન વ્યવસ્થા , બોટ વ્યવસ્થા, સ્થળાંતરની કામગીરી , સુરક્ષિત આશ્રયસ્થાનની વ્યવસ્થા વિગેરે કામગીરી , આશ્રયસ્થાનોમાં કુડ પેકેટ, પીવાનું પાણી, જીવન રક્ષક દવાઓ, રસીઓ, ક્લોરીન ટેબ્લેટ, જંતુનાશક દવાઓ તેમજ સફાઇ વિગેરેની વ્યવસ્થા નું આયોજન અને કોલ સેન્ટર ઉપરાંત ફરીયાદો માટે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવી , કન્ટ્રોલ રૂમ ખાતે માણસો-ટેલિફોન-વાહનો-મજુરો-સાધનો વિગેરેની વ્યવસ્થા અંગે ગહન ચર્ચા કરી આયોજન ઘડી કાઢવામાં આવેલ.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા